



KEMISTAR CORPORATION LTD.

CIN No. L24233GJ1994PLCO22845

604, Manas Complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad-380015,
Gujarat, India. Ph : 079-26923570 / 26923587 Email : kemistarbse@gmail.com

April 24, 2019

The Listing Manager
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001

Scrip Code: 531163

Dear Sir/Madam,

Sub: Postal Ballot Notice & Newspaper Advertisement confirming completion of dispatch of Postal Ballot Notice

Please find enclosed herewith:


1. Copy of the Postal Ballot notice along Postal Ballot form for seeking approval of members for Appointment of M/s. S. D. Mehta & Co., Chartered Accountants, (FRN: 137193W), as the Statutory Auditor of the company for filling the casual vacancy caused in the office of Statutory Auditor of the Company, due to resignation of M/s. Jignesh Domadiya & Co., Chartered Accountants (FRN: 131400W)
2. Copy of the newspaper advertisements published on April 23, 2019 regarding the completion of dispatch of Postal Ballot Notice and Form.

This is for your kind information and record

Thanking You,

Yours Faithfully

For, Kemistar Corporation Limited


Surya Menon
Company Secretary



Encl: As above

KEMISTAR CORPORATION LIMITED

CIN: L24233GJ1994PLC022845

Regd. Office: 604, Manas complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad-380015

Tel: 079-26923570 **Web:** www.kemistar.in **Email:** kemistarbse@gmail.com

NOTICE OF THE POSTAL BALLOT

[Notice Pursuant to Section 110 of the Companies Act, 2013, read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014]

Dear Member(s),

Notice is hereby given pursuant to Section 110 and other applicable provisions if any, of the Companies Act, 2013, (the “**Act**”) read together with the Companies (Management and Administration) Rules, 2014, (“**The Rules**”) including any statutory modification, amendment or re-enactment thereof for the time being in force and applicable Clauses of the Listing Regulations, that the Resolutions appended below is proposed to be passed as an Ordinary Resolution by way of Postal Ballot / e-voting. The Explanatory Statement pertaining to the said Resolution setting out the material facts concerning each item and the reasons thereof are annexed hereto along with the Postal Ballot Form (the “**Form**”) for your consideration.

The Board of Directors of the Company has appointed **Mr. Gaurav Zinzuwadiya**, Practicing Chartered Accountant (Membership No.150295), Ahmedabad as the Scrutinizer for conducting the Postal Ballot and e-voting process in a fair and transparent manner.

Members desirous of exercising their vote by Postal Ballot are requested to carefully read the instructions printed in the form, record your assent (for) or dissent (against) therein and return the same in original duly completed in the enclosed self-addressed business reply envelope. Postage will be borne and paid by the Company. Postal Ballot Form(s), if sent by courier or by registered post / speed post at the expense of the Member(s) will also be accepted. The Postal Ballot Form(s) may also be deposited personally at the address given on the self-addressed business reply envelope. The duly completed postal ballot form(s) should reach the Scrutinizer not later than 17.00 Hours IST on May 23, 2019, Thursday to be eligible for being considered, failing which, it will be strictly considered that no reply has been received from the Member.

The Company is pleased to offer Electronic Voting (‘**e-voting**’) facility established by National Securities Depository Limited as an alternative which would enable a member to cast votes electronically, instead of sending physical Postal Ballot Form. E-voting is optional. Shareholders may refer to notification relating to e-voting detailed in this notice.

The Scrutinizer will submit the report to the Managing Director of the Company, upon completion of scrutiny of Postal Ballots. The result of the Postal Ballot / e-voting shall be declared on May 25, 2019, Saturday and shall be communicated to the Stock Exchange, Depositories, Registrar and Share Transfer Agent and shall also be displayed on the Company’s Website.

Following resolution to be passed as Ordinary Resolution

1. APPOINTMENT OF STATUTORY AUDITOR TO FILL CASUAL VACANCY

To consider and, if thought fit, to pass the following resolution as an Ordinary Resolution:

“**RESOLVED THAT** pursuant to the provisions of Section 139(8) of the Companies Act, 2013 read with the Companies (Audit and Auditor Rules, 2014) including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force and pursuant to recommendation made by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on Wednesday, April 17, 2019 **M/s. S. D. Mehta & Co., Chartered Accountants** (Firm Registration No. **137193W**), Ahmedabad be and are hereby appointed as Statutory Auditors of the Company to fill the casual vacancy caused due to resignation of M/s. Jignesh Domadiya & Co., Chartered Accountants (Firm Registration No. 131400W), Ahmedabad.

RESOLVED FURTHER THAT M/s. S. D. Mehta & Co., Chartered Accountants (Firm Registration No. **137193W**), Ahmedabad be and are hereby appointed at Statutory Auditors of the Company and that they shall hold office of the Statutory Auditors of the Company from the conclusion of this meeting until the conclusion of the ensuing Annual General Meeting and that they shall conduct the Statutory Audit for the financial year ended on 31st March, 2019 on such remuneration as may be fixed by the Board of Directors in consultation with them.”

**By order of the Board of Directors
Kemistar Corporation Limited**

**Place: Ahmedabad
Date: April 17, 2019**

**Ketankumar Patel
Managing Director
(DIN: 01157786)**

NOTES:-

1. The Explanatory Statement pursuant to Section 102 of the Act stating all material facts are and reasons for the proposed Resolution is appended to the Notice.
2. The Postal Ballot Notice is being sent to all the Members, whose names appear in the Register of Members / list of Beneficial Owners, received from National Securities Depository Limited (NSDL) / Central Depository Services (India) Limited (CDSL) as on cut-off date i.e. Friday, April 19, 2019
3. As per Companies (Management and Administration) Rules, 2014, Notice of Postal Ballot is being sent to the Members in electronic form to the email addresses registered with their depository participants (in case of electronic shareholding) / the Company's Registrar and Share Transfer Agents (in case of physical Shareholding). For Members who have not registered their e-mail IDs, physical copy of the Notice of Postal Ballot along with Postal Ballot Form are being sent by permitted mode along with the postage pre-paid self-addressed business reply envelope. Members who have received Postal Ballot Notice by e-mail and who wish to vote through physical Postal Ballot Form may download the Postal Ballot Form from the link: <https://www.evoting.nsdl.com> or from the 'Investors' section on the Company's website www.kemistar.in.
4. Resolutions passed by the Members through Postal ballot are deemed to have been passed as if they have been passed at a General Meeting of the Members.
5. Voting period commences on and from 9.00 a.m. (IST) April 24, 2019, Wednesday and ends at 5.00 p.m. (IST) on May 23, 2019, Thursday. The e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by a Member, he or she will not be allowed to change it subsequently.
6. The Members can opt for only one mode of voting, i.e., either by Physical Ballot or Remote E-Voting. In case Members cast their votes through both the modes, voting done by Remote E-Voting shall prevail and votes cast through Physical Postal Ballot Forms will be treated as invalid.
7. The voting rights shall be reckoned in proportion to a Member's share of voting rights on the paid-up Equity Share capital of the Company as on April 19, 2019.
8. In compliance with the provisions of Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44(1) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has also extended e-voting facility as an alternate, for its Members to enable them to cast their votes electronically instead of dispatching Postal Ballot Form/s.
9. A Member cannot exercise his vote by proxy on postal ballot.
10. The Board of Directors of the Company has appointed Mr. Gaurav Zinzuwadiya, Practicing Chartered Accountant (Membership No.150295), as scrutinizer for conducting the Postal Ballot process in a fair and transparent manner and to receive and scrutinize the completed ballot papers from the Members. After completion of his scrutiny, the Scrutinizer will submit his report to the Managing Director and in his absence to the Company Secretary of the Company and the result of the Postal Ballot will be announced on Saturday, May 25, 2019 at the Registered Office of the Company by 5.00 p.m. The result of the Postal Ballot along with the Scrutinizer's Report will also be displayed on the Company's website www.kemistar.in and on the Notice Board of the Company at its Registered Office and on the website of NSDL viz. <https://www.evoting.nsdl.com> and shall be communicated to the Stock Exchange where the shares of the Company are listed.
11. The Postal Ballot form and the self-addressed business reply envelope are enclosed for use of members. Shareholders are requested to carefully read the instructions printed on the backside of the Postal Ballot Form before exercising their vote.
12. Resolutions passed by the Members through postal ballot are deemed to have been passed as if they have been passed at a General Meeting of the Members.
13. In case a Member is desirous of obtaining a printed Postal Ballot Form or a duplicate, he or she may send an e-mail to Registrar and Transfer Agent viz., Accurate Securities & Registry (India) Pvt. Ltd. at accurate.rta@gmail.com. The Registrar and Transfer Agent / Company shall forward the same along with postage -prepaid self- addressed Business Reply Envelope to the Member.

VOTING THROUGH PHYSICAL POSTAL BALLOT FORM

Members desirous of exercising their vote by Physical Postal Ballot are requested to carefully read the instructions printed in the Postal Ballot Form and return the Form duly completed and signed, in the enclosed self-addressed Business Reply Envelope to the Scrutinizer, so that it reaches the Scrutinizer not later than Close of Working Hours (i.e. 17:00 Hours IST) on Thursday, May 23, 2019. The postage will be borne by the Company. However, envelopes containing postal ballots, if sent by courier or registered / speed post at the expense of the Members will also be accepted. If any postal ballot is received after the said time and date, it will be considered that no reply from the Member has been received.

VOTING THROUGH ELECTRONIC MEANS (E-VOTING)

Pursuant to the provisions of Section 108, 110 of the Companies Act, 2013, read with the Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015; as amended from time to time, the Company is pleased to offer e-voting facility as an alternate to its members to cast their votes electronically on all resolutions set forth in the Notice of Postal Ballot. The Company has engaged the services of National Securities Depository Limited (NSDL) to provide the E-Voting facility.

How do I vote electronically using NSDL e-Voting system?

The way to vote electronically on NSDL e-Voting system consists of "Two Steps" which are mentioned below:

Step 1 : Log-in to NSDL e-Voting system at <https://www.evoting.nsdl.com/>

Step 2 : Cast your vote electronically on NSDL e-Voting system.

Details on Step 1 are mentioned below:

How to Log-into NSDL e-Voting website?

1. Visit the e-Voting website of NSDL. Open web browser by typing the following URL: <https://www.evoting.nsdl.com/> either on a Personal Computer or on a mobile.
2. Once the home page of e-Voting system is launched, click on the icon "Login" which is available under 'Shareholders' section.
3. A new screen will open. You will have to enter your User ID, your Password and a Verification Code as shown on the screen.

Alternatively, if you are registered for NSDL eservices i.e. IDEAS, you can log-in at <https://eservices.nsdl.com/> with your existing IDEAS login. Once you log-in to NSDL eservices after using your log-in credentials, click on e-Voting and you can proceed to Step 2 i.e. Cast your vote electronically.

Manner of holding shares i.e. Demat (NSDL or CDSL) or Physical	Your User ID is:
a) For Members who hold shares in demat account with NSDL.	8 Character DP ID followed by 8 Digit Client ID For example if your DP ID is IN300*** and Client ID is

	12***** then your user ID is IN300***12*****.
b) For Members who holdshares in demat account with CDSL.	16 Digit Beneficiary ID For example if your Beneficiary ID is 12***** then your user ID is 12*****
c) For Members holding shares in Physical Form.	EVEN Number followed by Folio Number registered with the company For example if folio number is 001*** and EVEN is 101456 then user ID is 101456001***

4. Your User ID details are given below
5. Your password details are given below:
 - a) If you are already registered for e-Voting, then you can user your existing password to login and cast your vote.
 - b) If you are using NSDL e-Voting system for the first time, you will need to retrieve the ‘initial password’ which was communicated to you. Once you retrieve your ‘initial password’, you need enter the ‘initial password’ and the system will force you to change your password.
 - c) How to retrieve your ‘initial password’?
 - (i) If your email ID is registered in your demat account or with the company, your ‘initial password’ is communicated to you on your email ID. Trace the email sent to you from NSDL from your mailbox. Open the email and open the attachment i.e. a .pdf file. Open the .pdf file. The password to open the .pdf file is your 8 digit client ID for NSDL account, last 8 digits of client ID for CDSL account or folio number for shares held in physical form. The .pdf file contains your ‘User ID’ and your ‘initial password’.
 - (ii) If your email ID is not registered, your ‘initial password’ is communicated to you on your postal address.
6. If you are unable to retrieve or have not received the “ Initial password” or have forgotten your password:
 - a) Click on “Forgot User Details/Password?”(If you are holding shares in your demat account with NSDL or CDSL) option available on www.evoting.nsdl.com.
 - b) Physical User Reset Password?” (If you are holding shares in physical mode) option available on www.evoting.nsdl.com.
 - c) If you are still unable to get the password by aforesaid two options, you can send a request at evoting@nsdl.co.in mentioning your demat account number/folio number, yourPAN,your name and your registered address.
7. After entering your password, tick on Agree to “Terms and Conditions” by selecting on the check box.
8. Now, you will have to click on “Login” button.
9. After you click on the “Login” button, Home page of e-Voting will open.
Details on Step 2 is given below:

How to cast your vote electronically on NSDL e-Voting system?

1. Now you are ready for e-Voting as the Voting page opens.
2. Cast your vote by selecting appropriate options i.e. assent or dissent, verify/modify the number of shares for which you wish to cast your vote and click on “Submit” and also “Confirm” when prompted.
3. Upon confirmation, the message “Vote cast successfully” will be displayed.
4. You can also take the printout of the votes cast by you by clicking on the print option on the confirmation page.
5. Once you confirm your vote on the resolution, you will not be allowed to modify your vote

General Guidelines for shareholders

1. Institutional shareholders (i.e. other than individuals, HUF, NRI etc.) are required to send scanned copy (PDF/JPG Format) of the relevant Board Resolution/ Authority letter etc. with attested specimen signature of the duly authorized signatory(ies) who are authorized to vote, to the Scrutinizer by e-mail to cagaurav512@gmail.com with a copy marked to evoting@nsdl.co.in.
2. It is strongly recommended not to share your password with any other person and take utmost care to keep your password confidential. Login to the e-voting website will be disabled upon five unsuccessful attempts to key in the correct password. In such an event, you will need to go through the “Forgot User Details/Password?” or “Physical User Reset Password?” option available on www.evoting.nsdl.com to reset the password.
3. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request to atevoting@nsdl.co.in

ANNEXURE TO THE NOTICE

Explanatory Statement Pursuant To Section 102 of The Companies Act, 2013.

M/s. Jignesh Domadiya & Co., (FRN:131400W) Chartered Accountants have tendered their resignation from the position of Statutory Auditors due to their pre-occupation, which resulted in casual vacancy in the office of Statutory Auditors of the Company as envisaged by Section 139(8) of the Companies Act, 2013. Casual vacancy caused by the resignation of auditor can be filled by the shareholders in General Meeting within three months from the date of recommendation of the Board of Directors of the Company. The Board of Directors of the Company recommended at its meeting held on April 17, 2019 that M/s. S D Mehta & Co., Chartered Accountants (Firm Registration No. 137193W), Ahmedabad be appointed to fill the casual vacancy caused by the resignation of M/s. Jignesh Domadiya & Co., Chartered Accountants as the Statutory Auditors of the Company.

M/s. S D Mehta & Co., Chartered Accountants (Firm Registration No. 137193W), have conveyed their consent to be appointed as the Statutory Auditors of the Company along with confirmation that, their appointment, if made by the members, would be within the limits prescribed under the Companies Act, 2013.

Accordingly, Ordinary Resolution is submitted to the meeting for the consideration and approval of members.

None of the Directors, Key Managerial Persons or their relatives, in any way, are concerned or interested in the said resolution.

Place: Ahmedabad
Date: April 17, 2019

Registered Office:
604, Manas Complex,
Jodhpur Cross Road,
Ahmedabad-380015,
Gujarat, India

**For and on behalf of the Board of Directors
Kemistar Corporation Limited**

**Ketankumar Patel
Managing Director
(DIN: 01157786)**

KEMISTAR CORPORATION LIMITED

Regd. Office: 604, Manas complex, Jodhpur Cross Road, Satellite, Ahmedabad-380015
Tel: 079-26923570 Web: www.kemistar.in Email: kemistarbse@gmail.com

CIN: L24233GJ1994PLC022845

POSTAL BALLOT FORM

Postal Ballot Form No.: _____

1	Name & Registered Address of the Sole/first-named Shareholder in BLOCK LETTERS	
	Name (s) of Joint Holders (if any)	
3	Registered Folio No. /DP ID No./ Client ID No.>(*Applicable to investors holding Equity Shares in dematerialized form)	
4	Number of Equity Shares held	

I / We, hereby exercise my / our vote in respect of the following 'Ordinary Resolution' to be passed through Postal Ballot for the Special Business stated in the Notice dated April 17, 2019 of Kemistar Corporation Limited (the "Company") by sending my /our assent (**FOR**) or dissent (**AGAINST**) to the said resolutions by placing the tick mark (✓) at the appropriate column below:

Item No.	Description of the Resolution	No. of Equity Share(s) held	I/We assent to the resolution (FOR)	I/We dissent to the resolution (AGAINST)
1	Appointment of M/s. S D Mehta & Co., Chartered Accountants as Statutory Auditor of the Company to fill the Casual Vacancy caused due to resignation of M/s. Jignesh Domadiya & Co. Chartered Accountants.			

Place:

Date:

(Signature of Member as per registered specimen)

Note:

- 1) Please read the instructions printed overleaf and in the notice of the postal ballot carefully before exercising your vote.
- 2) Last date for receipt of Postal Ballot Form by the Scrutinizer: May 23, 2019 Thursday (5:00 p.m.)
- 3) If the voting rights are exercised by e-voting, this form need not be used.

INSTRUCTIONS

1. A Member desirous of exercising her/ his vote by Postal Ballot may complete this Postal Ballot Form and send it to the following address of the Scrutinizer by post / courier.
Mr. Gaurav Zinzuwadiya, Scrutinizer,
Kemistar Corporation Limited
604, Manas Complex
Jodhpur Cross Road,
Ahmedabad - 380015, Gujarat, India
2. Please convey your assent / dissent in this Postal Ballot Form. The assent or dissent received in any other physical form shall not be considered valid.
3. This Form must be completed and signed (as per specimen signature registered with the Company) by the Member. In case of Joint-holding, this Form must be completed and signed by the first named Member and in his absence, by the next named Member.
4. Unsigned, incomplete or incorrectly ticked Postal Ballot Forms shall be rejected.
5. The Scrutinizer's decision on the validity of the Postal Ballot / e-voting will be final.
6. The Postal Ballot / e-voting shall not be exercised by a proxy.
7. In case of shares held by companies, trusts, societies, etc., the duly completed Postal Ballot Form should be accompanied by a certified copy of Board Resolution / Authorisation together with the specimen signature(s) of the duly authorised signatories.
8. Voting rights shall be reckoned on the paid-up value of shares registered in the name of the Member as on April 19, 2019.
9. Members are requested not to send any other paper along with the Postal Ballot Form and any extraneous paper found in such envelope would be destroyed by the Scrutinizer.
10. There will be one Postal Ballot Form for every Folio / Client ID, irrespective of the number of joint holders.
11. In case of non-receipt of the Postal Ballot Form or for any query related thereto, the Members may contact the company or its Registrar and Transfer agent, Accurate Securities & Registry (India) Pvt. Ltd. 203 Shangrila Arcade, Above Samsung Showroom, Nr. Shyamal Cross Road, Satellite, Ahmedabad – 380015 or send an email at accurate.rta@gmail.com or kemistarbse@gmail.com or download the Postal Ballot Form from the Company's website www.kemistar.in
12. The Members can opt for any one mode of voting i.e., either by physical Postal Ballot Form or e-voting. The voting, both through postal ballot and through electronic mode shall commence from April 24, 2019 at 09:00 a.m. and shall end on May 23, 2019 at 5:00 p.m. In case, member(s) cast their votes through both the modes, voting done by e-voting shall prevail and votes cast through physical Postal Ballot Forms will be treated as invalid.
13. The Company is pleased to offer e-voting facility, as an alternative, for all the members of the Company to enable them to cast their votes electronically instead of dispatching Postal Ballot Form. E-voting is optional. **THE DETAILED PROCEDURE FOR E-VOTING IS ENUMERATED IN THE NOTES TO THE POSTAL BALLOT NOTICE.**

SPYKAR launches athleisure denims - 'GYMJNS'

Ahmedabad: Summer just got hotter as Spykar, India's leading fashion denim brand launches a new range of athleisure denims, 'GYMJNS'. This is slated to be the next evolution in denims as it offers a '4-way dynamic stretch' and 'ergonomic construction,' making it the first-ever denim that can be worn for work-outs. Keeping in mind the demand for something cool, durable and versatile to match the fast-paced life of a millennial; this is perfect denim for the gym and outside too!

Sanjay Vakharia, CEO of Spykar Lifestyle said, "Millennials are time-conscious, ambitious, and always on the go. They love sharing everything they do and want versatility & utility in what they use. With Spykar GYMJNS, they can now seamlessly move from active leisure to work, without having to change their outfit."

By offering the user



unrestricted freedom of movement, Spykar GYMJNS are designed for the outrageously stylish fitness enthusiast. Available in 18 styles for men and women, this denim is ideal for those who like to pack their day with many exciting things including work-outs. These pair of Spykar GYMJNS are super comfortable and stretchy with a great fit and sporty styling. Matching the products features, the campaign tagline #BeExtra complicates with the target audience which is millennials. (19-10)

33rd National PR Day celebrated



Ahmedabad: PRSI Ahmedabad Chapter organized a wonderful Talk show by Entrepreneur and Social activist - Ms. Ruzan Khambatta followed by a theatrical show HORN OK Please which focused on importance of Road Safety and use of HSRP number plates in Vehicles. The show appealed to the young children of VISAMO KIDS Foundation to safeguard National Integrity and respect for Indian Army. At the same time the show requested the Children to understand and follow the basics of Road Safety and understand as to how High Security Registration plates are a boon for the Nation.

Using the theme of following traffic rules and road safety, a 15 minute theatrical group led by Art Director Chinmay Mehta under the banner of HSC

PASS group performed beautifully to spread awareness in enthusiastic kids of Visamo kids Foundation. It was indeed an apt show organized on 33rd National PR Day organized by PRSI - Ahmedabad Chapter and FTA HSRP Pvt Limited in collaboration with T MAN and HSC Pass.


Mr. Paresh Dave, Director, Traffic Man, shared, "I personally thank Ms. Ruzan Khambatta, Shri Umesh Dixit, Mr. Subhojit Sen, Mr. R. K. Singh, Mr. Dilip Chauhan, Mr. Anuj Narula, Shri Chinmay Mehta and all Officials of PRSI - Ahmedabad Chapter for their kind presence on this occasion. I wish to specially thank all media friends for being here and for helping us in spreading this movement of National PR Day, road safety and HSRP to the society at large." (19-8)

Wharton School Invites Students to Apply to a Summer Finance Program



Ahmedabad: Knowledge@Wharton High School (KWHS), a part of the Wharton School of the University of Pennsylvania, is accepting applications for its summer program on finance. The latest addition to the KWHS Global Young Leaders Academy (GYLA) will provide an Ivy League experience at the Wharton School, focusing on finance and investment. KWHS GYLA-Finance will conduct three two-week sessions from June to August in 2019 (Session A: June 23-July 6; Session B: July 7-20; Session C: July 21-August 3). At the Philadelphia

Serguei Netessing, Vice Dean for Global Initiatives and the Dhruvahi Ambani Professor of Innovation and Entrepreneurship at the Wharton School, said, "Building on the success of the GYLA entrepreneurship program, we are excited to introduce a new finance program for high school students. They will enjoy rigorous academics in personal and corporate finance, as well as activities and exploration outside the classroom that open their eyes to life in the U.S. and on an Ivy League campus. For more details, visit the website:




The Vice President, Shri M. Venkiah Naidu paying tributes to the Statue of Swami Vivekananda at the premises of Swarna Bharat Trust, in Hyderabad on April 20, 2019.

Devendra Fadnavis on 'two things' Rahul Gandhi's speeches are known for

Addressing a poll rally at Sankhalim in support of BJP Lok Sabha candidate Shripad Naik, he said Gandhi's speeches are known for his curses against Prime Minister Narendra Modi and also for their "humour quotient".

Taking a jibe at the Congress 'Nay' scheme, that promises to provide Rs 72,000 per year to the five crore poorest families, Fadnavis said Gandhi is not sure from where money for the programme will come. (AFP FILE)

Maharashtra Chief Minister Devendra Fadnavis Thursday took potshots at Congress president Rahul Gandhi, saying his speeches have high "humour quotient" and he need not be taken seriously. Addressing a poll rally at Sankhalim in support of BJP Lok Sabha candidate Shripad Naik, he said Gandhi's speeches are known



for his curses against Prime Minister Narendra Modi and also for their "humour quotient". "Rahul Gandhi's speeches are known for two things. One is that he utters curses against Prime Minister Modi and second is that he is known for his jokes," Fadnavis said.

"Like the way television channels run their serials with disclaimers that they are not responsible for the content, Rahul Gandhi's speeches should also run with the disclaimer that whatever he says is not a reality," the BJP Chief Minister said. Taking a jibe at the Congress 'Nay' scheme, that promises to

provide Rs 72,000 per year to the five crore poorest families, Fadnavis said Gandhi is not sure from where money for the programme will come.

During a press conference when Rahul Gandhi was asked from where he will source the fund for the scheme, he was confused and started looking at former Finance Minister Chidambaram," he said. "Chidambaram reacted by saying that money is flowing in central government coffers and this can be distributed to the poor," Fadnavis said. Money started accumulating in government coffers after Modi launched a drive against black money, he said.

"Why should the Congress distribute it? The Modi government will give it to the poor when a new government is formed," he said.

Curtain Raiser - Naval Commanders' Conference 2019/1

New Delhi: The first edition of Naval Commanders' Conference of 2019 is scheduled at New Delhi from 23 to 25 April 2019. The conference is the apex forum within the Service for interaction between the Naval Commanders. The Chief of the Naval Staff, with the Commanders-in-Chief, will review major operational, materiel, logistics, HR, training and administrative activities undertaken during the previous six months and deliberate upon the course to be steered in the ensuing six months.

The Conference assumes greater significance in the backdrop of Pulwama associated events that have brought country's defence under sharper focus and will provide the higher naval leadership a forum to discuss the emerging challenges in the maritime domain and fine tune the strategies for responding to the evolving geo-strategic environment.

Naval Commander-in-Chief, will review major operational, materiel, logistics, HR, training and administrative activities undertaken during the previous six months and deliberate upon the course to be steered in the ensuing six months.

The Conference assumes greater significance in the backdrop of Pulwama associated events that have brought country's defence under sharper focus and will provide the higher naval leadership a forum to discuss the emerging challenges in the maritime domain and fine tune the strategies for responding to the evolving geo-strategic environment.

Naval Commander-in-Chief, will review major operational, materiel, logistics, HR, training and administrative activities undertaken during the previous six months and deliberate upon the course to be steered in the ensuing six months.

synergy and readiness to deter and neutralise threats aimed at the country's sovereignty and territorial integrity.

The themes of 'Functional Reorganisation of Indian Navy towards improving Operational Efficiency and Optimal Manning' will form the core of discussions towards finalising long term road map for the IN.

Discussions are planned on acquisition of new capabilities, harnessing niche technologies like 'Big Data Analytics' and 'Artificial Intelligence' for solutions in the domains of naval combat, convergence of networks/ information, logistics, administration and equipment - health monitoring for sustained operations.

In keeping with the expectation of IN being the Net Security Provider in the IOR and first responder to any crisis, the forum will also deliberate upon the lessons learnt from the recently concluded HADR operations by the IN and various other maritime security initiatives such as the IFC-IOR. In keeping with the expectation of IN being the Net Security Provider in the IOR and first responder

Navya ties up with Priyanka Jariwala Memorial Foundation (PJMFM) to reach out to needy cancer patients



Surat: With an aim to revolutionise cancer care in the country, Navya (www.navya.care) has tied up with Priyanka Jariwala Memorial Foundation (PJMFM) based in Surat to reach out to needy cancer patients. Navya is a clinical informatics company, founded in collaboration with Tata Memorial Centre (TMC) and National Cancer Grid (NCG) to provide online expert opinions to cancer patients. This association will help poor cancer patients from the state to reach out to Navya Expert Opinion Service through Priyanka Jariwala Memorial

Foundation (PJMFM) to reach out to needy cancer patients and receive an expert opinion from the comfort of their home. Since 2015, Navya's Online Expert Opinion Service has been used by over 28,000 patients from 68 countries. Navya has a simple goal of reaching every cancer patient across the world and empowering them with information and clarity when they are faced with the challenge of making complex medical decisions.

PJMFM was set up in 2017 as a private charity organisation in Surat with the main goal to provide financial and emotional support to needy cancer patients and

AXELOS launches ITIL 4 Foundation



Ahmedabad: With the release of the new ITIL® 4 Foundation courses AXELOS has officially launched ITIL 4. This is the latest update of the world's most widely used service management framework.

ITIL 4 has been designed to provide a practical and flexible basis to support organizations with their IT and digitally-enabled product and service delivery. The updated framework looks at an end-to-end operating model for creation, delivery and continual improvement. It covers development, operations, business relationships and governance in a holistic way, ensuring all functions across the organization are working towards common objectives. (1-7)

President's Easter Greetings

New Delhi: The President of India, Shri Ram Nath Kovind in his message on the eve of Easter has said:

"On the occasion of Easter, I extend my greetings and best wishes to all fellow citizens, especially to members of the Christian community in India and abroad.

"I extend my greetings and best wishes to all fellow citizens, Easter is celebrated across the world to commemorate the resurrection of Jesus Christ. Christ symbolised the principles of humanism, love and truth. On this joyous occasion, let us commit ourselves to these values and to building a happy and fraternal nation," especially to members of the Christian community in India and abroad.

"Easter is celebrated across the world to commemorate the resurrection of Jesus Christ. Christ symbolised the principles of humanism, love and truth.

KEMISTAR CORPORATION LIMITED

604, Manas Complex, Near Jodhpur Cross Road Sellite, Ahmedabad Gujarat - 380015
TIN: 12-223232-2264
Email: kemistarsat@gmail.com Web: www.kemistar.in

NOTICE

The members of the Company are hereby informed that pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, the Company has on April 22, 2019 completed the discharge of Postal Ballot Notice along with Postal Ballot Form and a pre-paid self-addressed envelope to the members of the Company for seeking approval of the members of the Company for:

1. Appointment of M/S S D Mehta & Co. (FIR - 137193V) Chartered Accountants, to fill the casual vacancy caused due to resignation of M/S Jignesh Dombani & Co., Chartered Accountants (FIR - 131000V).

The Notice has been sent to all the members whose name appear on the Register of Members of Beneficial Owners as on April 19, 2019 as received from National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL). The voting rights of the members shall be reckoned as on April 19, 2019. The Board of Directors of the Company has appointed Mr. Gaurav Zinwadia, Practising Chartered Accountant (Membership No. 150295) as the Scrutinizer for conducting the postal ballot process in a fair and transparent manner. The detailed procedure for exercising the vote is contained in the Postal Ballot Notice. The members can opt for only one of the two modes of voting i.e. either through the Postal Ballot Form or e-voting. The voting, both through postal ballot and through electronic mode shall commence from April 24, 2019 at 9:00 a.m. and shall end on May 23, 2019 at 5:00 p.m. In case, members' card their votes through both the modes, voting done by e-voting shall prevail and voters cast through physical Postal Ballot Form shall be treated as invalid. Members are requested to note that the duly completed and signed Postal Ballot Forms should reach Mr. Gaurav Zinwadia, Scrutinizer, Kemistar Corporation Limited, 604, Manas Complex, Jodhpur Cross Road, Ahmedabad-380015, Gujarat, India, not later than 05:00 p.m. on May 23, 2019. Any Postal Ballot Form received from the members after 05:00 p.m. on May 23, 2019 will be strictly treated as if it has not been received.

The Postal Ballot Notice and Form can be downloaded from our website www.kemistar.com. In case of non-receipt of the Postal Ballot Form or for any unexplained delay in receiving the Postal Ballot Form or for electronic mode, members are requested to contact the company or its Registrar and Transfer agent at kemistarsat@gmail.com or 079-22649676. Members can also write to the Company Secretary at the Registered Office of the Company or send an email at kemistarsat@gmail.com.

The Notice of Postal Ballot will be announced on May 25, 2019 at the registered office of the Company. The aforesaid result will be displayed at the Registered Office of the Company intended to use Limited, the Stock Exchange where the Company's shares are listed, published in the newspapers and displayed along with the Scrutinizer's report on the Company's website viz. www.kemistar.in.

By order of the Board
For, Kemistar Corporation Limited
Ketankumar Patel
Managing Director

Date: April 22, 2019
Place: Ahmedabad

FEDERAL BANK

The Federal Bank Ltd., LCDRD/ Mumbai Division. Address: 134, 135-136, Jolly Maker Chambers No. 2, Nariman Point, Mumbai, 400 021. E-mail: mumbai@federalbank.co.in | Phone: 022 - 22537312, 022 - 22546676
Loan Collection & Recovery Department / Mumbai Division

Ref No: BBT07/BNS/SALE PNB / 2019-20 20-04-2019

Sale Notice for Sale of Immovable Assets Under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to 6 (4) of the Security Interest Enforcement) Rules, 2002 (Notice is hereby given to the public in general and in particular to the borrower and Guarantors that the below described immovable property mortgaged/charged to the Federal Bank Ltd (Secured Creditor), the physical possession of which has been taken by the Authorized Officer of The Federal Bank Ltd (Secured Creditor), will be sold on 06-05-2019 "As is where is", "As is what is" and "Whatever there is Basis" for recovery of Rs. 35,32,743.00 (Rupees Thre Five Lakh Thre Thousand Seven Hundred Forty Thre Only) as on 06/05/2019 due to the Federal Bank Ltd (Secured Creditor) as on the aforesaid date of sale from M/s. Nimeshshubh Shubhaghat Rathod 2) Mr. Indrajith Bhagubhai Rathod and 3) Mr. Bhupatkar Ramnath Rathod. The Reserve price will be Rs. 6,10,000/- (Rupees Six Lakh Ten Thousand only) and the earnest money deposit will be Rs. 61,000/- (Rupees Sixty One Thousand only).

DESCRIPTION OF THE PROPERTIES

All that part and parcel of residential flat No. 94/C, Second Floor, Ram Bahin Society having built up area 105.63 sq. Meter and steps and cabin admeasuring 0.36 sq meter along with all the improvements thereon situated at plot no 92 of village-Sardar Nagra, Bhavnagar and District-Sardar Nagra Gujarat State and bounded on north by plot no 93, South by road no 91, East by Road and West by

